

Tatva Chintan Pharma Chem Limited

(Formerly known as Tatva Chintan Pharma Chem Private Limited) (CIN:L24232GJ1996PLC029894)



Date: 17 August 2022

Ref No: TCPCL/SEC/2022-23/00048

To,
The General Manager,
Corporate relationship department,
BSF Limited

BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai-400 001
Scrip Code: 543321

The Manager, Listing department, National Stock Exchange of India Limited Exchange Plaza, C-1, Block-G, Bandra-Kurla, Complex Bandra(E), Mumbai-400 051 Scrip Symbol: TATVA

<u>Subject: Newspaper Advertisement - Disclosure under Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('SEBI Listing Regulations')</u>

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A and Regulation 47 of the SEBI Listing Regulations and in compliance with the General Circulars dated 08 April 2020, 13 April 2020, 05 May 2020, 13 January 2021, 14 December 2021 and 05 May 2022 issued by Ministry of Corporate Affairs, please find enclosed herewith the copies of newspaper advertisement published in Financial Express (in English Language) and Vadodara Samachar (in Gujarati Language) on 17 August 2022, intimating that the 26th Annual General Meeting ("AGM") of the Company will be held on Thursday, 22 September 2022 at 04:00 p.m. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM").

The above information shall be made available on the website of the Company at www.tatvachintan.com.

Kindly take the above information on record.

Thanking you,

Your Faithfully,

For Tatva Chintan Pharma Chem Limited

Ishwar Nayi

Company Secretary and Compliance Officer

M. No.: A37444

Encl.: As above



Tender No.

Name of Supply

Estimated Cost

Delivery Schedule

submission of bid

Cost of Tender Document

Tender Processing Fee

Last Date & Time of tender

Date & Time of opening of bid On 08.09.2022 at 12.00 hrs.

भारतीय कंटेनर निगम लिमिटेड CONTAINER CORPORATION OF INDIA LTD. Navratna Company (A Govt. of India Undertaking) COR Annex, NSIC MDBP Building, 3" Floor, Okhla Industrial Estate, New Delhi-110020 NOTICE INVITING E - TENDER Online open e-tender in Two bid system is invited for the supply of 16467 nos, Intermediate Twist Locks for double stack /double decker container train at various terminals of CONCOR. CON/A-II/T/ITL/2022 dated 17.08.2022 Supply of 10467 nos. Intermediate Twist Locks Semi-Automatic Automatic for double stack/double decker container train at various terminals of CONCOR as per RDSO's specifications. Rs. 1.84.77.186 (inclusive of GST as applicable) 240 days (As per Section-IV)

www.tenderwizard.com/CCIL only. Further, Corrigendum/ Addendum to this Tender, if any, will be ublished on website www.concorindia.com, www.tenderwizard.com/CCIL and Central Procurement Portal (CPP) only. Newspaper press advertisement shall not be issued for the same. Group General Manager/Technical/Area-II, Phone no.: 011-41222530 National Institute of Technology, Uttarakhand (An Autonomous Body under the Ministry of Education) emporary Campus: Govt. ITI, Srinagar, Dist: Pauri Garhwal, Uttarakhand-246174 Website: www.nituk.ac.in, Email: nitukrecruitmentcell@gmail.com

Rs. 1000/- inclusive of GST through e-payment

Rs. 4720/- inclusive of GST through e- payment

Date of Sale of Tender (online) From 17.08.2022 after 11.00 hrs. to 07.09.2022 up to 13:00 hrs.

On or before 07.09.2022 up to 18.00 hrs

For financial eligibility criteria, experience etc, please refer to detailed tender notice available on website

www.concorindia.com, but the complete tender document can be downloaded from website

NOTIFICATION nstitute invites online/offline application(s) from the eligible candidates for the filling up of following Teaching/Non-Teaching post(s) and admissions in Ph. D./M.Tech: Civil, Computer Science, Electrica Electronics, Mechanical, Chemistry Advt. No.6/2022: Professor post(s): Humanities and Social Mathematics and Physics- as per vacancy

Advt. No.7/2022: Officers post(s): Registrar, Dy. Registrar, Assistant Librarian, Executive Engine (Civil), Medical Officer Advt. No.8/2022: Non-Teaching post(s): Superintendent, SAS Assistant, Junior Engineer (Civil/Electrical), Technical Assistant, Stenographer, Junior Assistant, Technician and Office

Advt. No.9/2022: Ph.D. (for odd semester 2022)/M.Tech admission (self-sponsored category) The applicants may refer the Institute website www.nituk.ac.in for the details of education qualification, experience, age and last date for submission of online/offline application and other terms & conditions for the filling up of application(s) for the above post(s) and admissions. Any addendum/corrigendum shall be posted only on the Institute website. Applicants/incumbents are requested to visit the Institute website regularly Ref. No. NITUK/Estt./2022/Advt./039/789 Date: 18/08/2022

Tuni Textile Mills Limited Regd. Office: Suite 267, Bldg. 5B, 2nd Floor, Mittal Industrial Estate, Andheri Kurla Road, Andheri (E), Mumbai 400 059 CIN: L17120MH1987PLC043996 Email: info@tunitextiles.com, Web: www.tunitextiles.com Statement of Un-Audited Financial Results for the Quarter ended 30th June 2022

				J
Sr No.	PARTICULARS	Quarter ended 30th June 2022 Un-Audited	Quarter ended 30th June 2021 Un-Audited	Year Ended 31st March 2022 Audited
2	Total Income from Operations (Net) Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or	806.84	657.46	4,188.40
3	Extraordinary items Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or	8.38	4.63	30.01
4	Extraordinary items Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or	8.38	4.63	30.01
5	Extraordinary items Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other	4.82	3.20	27.92
6	Comprehensive Income (after tax)] Paid-up Equity Share Capital	6.34	3.21	34.03
7	(Face Value of Rs. 1/- each) Other Equity Earning Per Share (before Extra- Ordinary items) of Rs.1/- each (for continuing and discontinued operations)	1,306.31	1,306.31	1,306.31 (45.94)
(i)	a) Basic b) Diluted	0.00 0.00	0.00 0.00	0.02 0.02

The above is an extract of the detailed format of Standalone Un-Audited Financial Results for the quarter ended 30th June 2022 filed with the Stock Exchange/s under Regulation 33 of the SEBI LODR Regulations, 2015. The full format of the Un-Audited results for the Quarter ended 30th June 2022 is available on the Company website "www.tunitextiles.com" and on the Stock Exchange website i.e. www.bseindia.com.

> For Tuni Textile Mills Limited Narendra Kr. Sureka

(Figures in Lacs except EPS)

Place: Mumbai Date :August 12, 2022 **Managing Director**

NANDANI CREATION LIMITED Nandani

mentioned in detailed advertisement

Regd. Office: G-13, Kartarpura Industrial Area, Near 22 Godam, Jaipur-302006 Phone: 0141-4037596, CIN: L18101RJ2012PLC037976 Web-site: www.nandanicreation.com, e-mail:info@jaipurkurti.com, cs@jaipurkurti.com EXTRACT OF UNAUDITED STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS OF THE COMPANY FOR THE QUARTER ENDED 30th JUNE, 2022

Sr. No.	PARTICULARS	STANDALONE			CONSOLIDATED				
		QUARTER ENDED		YEAR ENDED	QUARTER ENDED			YEAR ENDED	
		3.55678 NOSUM 200	31.03.2022	30.06.2021	31.03.2022 (AUDITED)	30.06.2022 (UNAUDITED)	31.03.2022 (AUDITED)	30.06.2021 (UNAUDITED)	31.03.2022 (AUDITED)
			(AUDITED)	(UNAUDITED)					
1	Total Income from Operations	1319.70	1185.83	1388.25	5551.02	1466.09	1621.48	1383.52	6335.84
2.	Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	56.35	(37.44)	119.16	21.59	56.92	(42.61)	137.00	68.33
3.	Net Profit/(Loss) for the period before Tax, (After Exceptional and/or Extraordinary Items)	56.35	(37.44)	119.16	21,59	56.92	(42.61)	137.00	68.33
4.	Net Profit/(Loss) for the period after Tax, (After Exceptional and/or Extraordinary Items)	38.63	(37.02)	84.63	10.20	38.74	(40.67)	99.04	49.58
5.	Total Comprehensive Income for the period	38.48	(36.63)	84.70	10.69	38.74	(40.16)	99.11	50.18
6.	Paid-up Equity Share Capital (face value of Rs. 10 each)	1003.39	1003.39	1003.39	1003.39	1003.39	1003.39	1003.39	1003.39
7.	Earnings per Share (Face Value of Rs. 10/- each) Basic & Diluted (not annualized for quarters)	0.38	(0.37)	0.84	0.10	0.39	(0.40)	0.99	0.61

A) The results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meeting held on 14th August, 2022. B) The above is an extract of the detailed format of Standalone and Consolidated Financial Results for the Quarter ended 30th June, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations & Disclosure Requirement) Regulat ions, 2015. The full Format of the statement of Standalone Financial Results are available on the Company's website (www.nandanicreation.com) and on the website of the National Stock Exchange of India limited (www.nseindia.com).

DATE: 14.08.2022 PLACE: JAIPUR

ANUJ MUNDHRA **CHAIRMAN & MANAGING DIRECTOR** DIN: 05202504

FOR NANDANI CREATION LIMITED

Standard Chartered Capital Limited

(Formerly known as Standard Chartered Investments and Loans (India) Limited) CIN: U65990MH2003PLC142829

Registered Office: Crescenzo, 6th Floor, G Block, C-38/39, Bandra Kurla Complex, Bandra (East). Mumbai - 400 051, Maharashtra, India. Website: www.standardcharteredinvestmentsloans.co.in

Toll Free No.: (91-22) 18002090505, Fax: 022-61157825

Email ID: SCCapital.customercare@sc.com



STATEMENT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022 [Regulation 52(8), read with regulation 52(4) of the Listing Regulations]

(INR Lacs)

S. No.	Particulars	Quarter Ended			Year Ended	
		June 30, 2022	March 31, 2022	June 30, 2021	March 31, 2022	
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)	
1	Total Income from Operations	9,947	8,622	6,232	30,746	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items*)	3,692	4,368	2,135	12,189	
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items ^e)	3,692	4,368	2,135	12,189	
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items*)	2,750	3,269	1,583	9,077	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after Tax) and Other Comprehensive Income (after tax)]	2,750	3,241	1,583	9,048	
6	Paid Up Equity Share Capital	45,439	45,439	45,439	45,439	
7	Reserves (Excl Revaluation Reserves)	63,902	61,153	53,686	61,153	
8	Securities Premium Account	5	8 -7 8	170	15	
9	Net worth	1,09,340	1,06,591	99,125	1,06,592	
10	Paid up Debt Capital / Outstanding Debt	4,03,087	3,60,002	2,51,652	3,60,002	
11	Outstanding Redeemable Preference Shares	#0	-		9	
12	Debt Equity Ratio	3.69	3.38	2.54	3.38	
13	Earnings per share of face value of Rs. 10 each (for continued and discontinued operations)					
	(a) Basic (Rs.)	0.61	0.72	0.35	2.00	
	(b) Diluted (Rs.)	0.61	0.72	0.35	2.00	
14	Capital Redemption Reserve	*	-	S#3	98	
15	Debenture Redemption Reserve	5/	0.70	15733		
16	Debt Service Coverage Ratio	NA	NA	NA	NA	
17	Interest Service Coverage Ratio	NA	NA	NA	NA	

* Exceptional and/or Extra Ordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind AS Rules / AS Rules, whichever is applicable.

Notes:

- (a) The above is an extract of the detailed format of quarterly/annual financial results filed with the Stock Exchanges under Regulation 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results is available on the websites of the Stock Exchange and the listed entity Standard Chartered Capital Limited (http://www.standardcharteredinvestmentsloans.co.in/Investors_FinancialResults.html)
- (b) For the items referred in Regulation 52 (4) of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015, the pertinent disclosures have been made to the Stock Exchange (Bombay Stock Exchange) and can be accessed on the URL (http://www.standardcharteredinvestmentsloans.co.in/Investors FinancialResults.html)

For and on behalf of the Board of Directors of Standard Chartered Capital Limited

(Formerly known as Standard Chartered Investments and Loans (India) Limited)

Prashant Kumar MD & CEO DIN No: 08584379

Adfactors 239



SRI ADHIKARI BROTHERS TELEVISION NETWORK LIMITED CIN: L32200MH1994PLC083853

Regd. Off.: 6th Floor, Adhikari Chambers, Oberoi Complex, New Link Road, Andheri (West), Mumbai 400 053, E-mail: sriadhikaribrothers@kanchansobha.com. Website: www.adhikaribrothers.com; Tel.: 022 - 4023 0000; Fax: 022 - 2639 5459

NOTICE TO SHAREHOLDERS FOR ANNUAL GENERAL MEETING Notice is hereby given that the 27° (Twenty Seventh) Annual General Meeting ("AGM") of the members of Sri Adhikari Brothers Television Network Limited ("the Company") will be held on Monday, 12" of September, 2022 at 3:00 p.m. (IST) through Video Conferencing ("VC")/Other Audio -Visual Means ("OAVM"), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 ("Act") and rules framed thereunder read with General Circular dated April 8, 2020, April 13, 2020 and May 5, 2020 and January 13, 2021, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("the Regulations") read with SEBI Circular dated May 12, 2020 and January 15, 2021.

In compliance with the aforementioned circulars, the Notice of the AGM along with Annual Report for the Financial Year 2021-2022 will be sent only through electronic mode by e-mail to those Members, whose names appear in the Register of Members / Beneficial Owners maintained by the Depositories as on Saturday, August 20, 2022 and whose email addresses are registered with the Company or the Registrar and Share Transfer Agents or their respective Depositories. Members can join and participate in the AGM through VC/OAVM only. The instructions for joining the AGM and the manner of participation in the Remote e-voting or casting vote through E-voting during AGM will be provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Act. The Notice and the Annual Report will also be made available on the website of the Company at www.adhikaribrothers.com, website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively, and on the website of the NSDL at https://www.evoting.nsdl.com. Necessary arrangements have been made by the Company with NDSL to facilitate Remote e-voting and E-voting during the AGM.

The Members who are holding shares in physical form or who have not registered their e-mail address with the Company / Depository or any person who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company, and holds shares as of the cut-off date, i.e Thursday, August 11, 2022, may obtain the User ID and password by sending a request at helpdesk.evoting@nsdl.com or rnt.helpdesk@linkintime.co.in . However, if a Member is already registered with NDSL for Remote e-voting and E-voting, then existing User ID and password can be used for casting vote.

The Members who have not registered their email address and holding Equity Shares in Demat form are requested to register their e-mail address with the respective Depository Participant ("DP") and the Members holding Equity Shares in physical Form may get their e-mail addresses registered with Registrar & Share Transfer Agent ("RTA") of the Company i.e. Link Intime (India) Private Limited by sending the request at rnt.helpdesk@linkintime.co.in. The Members are requested to provide details such as Name, Folio Number, Certificate number, PAN, mobile number and e-mail id, etc.

The Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for joining the AGM, manner of casting vote through Remote e-voting and E-voting during the AGM and attending the AGM

> For Sri Adhikari Brothers Television Network Limited (Company under Corporate Insolvency Resolution Process,

Place: Mumbai

Resolution Professional Reg. No. IBBI/IPA-001/IP-P00721/2017-2018/11253 AFA valid up to 03/04/2023

(Formerly known as

Tatva Chintan Pharma Chem Private Limited) CIN: L24232GJ1996PLC029894

Website: www.tatvachintan.com, E-mail: cs@tatvachintan.com,

NOTICE ON INFORMATION REGARDING 26TH ANNUAL GENERAL MEETING OF TATVA CHINTAN

PHARMA CHEM LIMITED TO BE HELD THROUGH VIDEO CONFERENCING ("VC") /

Notice is hereby given that :

CHINTAN PHARMA CHEM LIMITED ("the Company") will be held through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") on Thursday, 22 September 2022 at 04:00 P.M. (IST), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the relevant Rules made there under and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations"), as amended from time to time, read with General Circular issued by the Ministry of Corporate Affairs dated 8 April 2020, 13 April 2020, 5 May 2020, 13 January 2021, 14 December 2021 and 5 May 2022 and all other applicable circulars, if any, issued by the Ministry of Corporate Affairs ("MCA") from time to time and Circulars dated 12 May 2020, 15 January 2021 and 13 May 2022 issued by the Securities and Exchange Board of India ("SEBI") from time to time (hereinafter collectively referred to as the "Circulars"), to transact the business set out in the Notice calling the 26" AGM.

The detailed instructions with respect to such participation will be provided in the Notice convening the AGM. Members participating through the VC / OAVM mode shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

- with the Annual Report for the Financial Year 2021-22, will be sent through electronic mode to those Members whose email addresses are registered with the Company / Depositories. Members may note that the said Notice and Annual Report will also be available on the Company's website www.tatvachintan.com, websites of the Stock Exchanges i.e. BSE Limited ("BSE") and National Stock Exchange of India Limited ("NSE") at www.bseindia.com and www.nseindia.com respectively and on the website of Link Intime India Private Limited, an agency appointed for conducting Remote e-voting, e-voting during the process of AGM and VC at https://instavote.linkintime.co.in.
- Manner of registering / updating (1). Email addresses in order to facilitate the Company to serve the documents through the electronic mode and (2)
- i. Members holding shares in physical mode, who have not registered
- ii. Members holding shares in dematerialized mode, who have not registered / updated their email addresses / Bank Account Details with their Depository Participants, are requested to register / update the same with the Depository Participants with whom they maintain their

Manner of casting vote(s)through e-voting :

- Members will have an opportunity to cast their votes on the business as set out in the Notice of the 26th AGM through electronic voting system ("e-voting").
- ii) The manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses has been provided in the Notice of the AGM.
- iii) The facility of e-voting through electronic voting system will also be made available at the AGM. Only those shareholders, who are present in the AGM through VC / OAVM facility and who have not cast their vote on the Resolutions through remote e-Voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system available during the AGM.
- 5. Members are requested to carefully read all the Notes set out in the Notice of the 26" AGM dated 25 July 2022 and in particular, instructions for joining the AGM, manner of casting vote through remote e-voting or e-voting during the process of AGM.

By Order of the Board For Tatva Chintan Pharma Chem Limited Ishwar Nayi Company Secretary and Compliance Officer

M. No.: A37444

"IMPORTANT"

advertisers or otherwise acting on

Whilst care is taken prior to acceptance advertising copy, it is not possible to verify its contants. The Indian Express (P) Limited cannot be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of transactions with companies, associations or individuals adversing in its newspapers or Publications. We therefore recommend that readers make necessary inquiries before sending any monies or entering into any agreements with

भारतीय कंटेनर निगम लिमिटेड CONTAINER CORPORATION OF INDIA LTD. (भारत सरकार का उपक्रम) (A govt. of India Undertaking) CONCOR Annex, NSIC MOBP Building, 3" Floor, Okhla Industrial Estate, New Delhi - 110021 कॉनकॉर CONCOR

Last Date & Time of submission | On 01/09/2022 upto 15:00 hrs.

Online E-Bids are invited for e-tender-cum-reverse auction for Handling & Terminal Transportation of containers at CRT Maliya; and Road Transportation of domestic containers ex CRT, Maliya, (Gujrat) for 02 years through e-tendering mode. CON/Area-II/H&T-RTO/MALB/2022 Tender No. Rs.9,69,91,500/-(including GST) for 02 years Estimated Cost From 17/08/2022 at 15:00 hrs. to 31/08/2022 (upto 16:00 hrs.) Date of Sale (On Line)

TENDER NOTICE (E-Tendering Mode Only)

Date & Time of Opening On 01/09/2022 at 15:30 hrs. For eligibility criteria and other details please log onto www.concorindia.com or eprocure.gov.in or www.tenderwizard.com/CCIL. Bidders are requested to visit the websites regularly. CONCOR reserves the right to reject any or all the tenders without assigning any reasons thereof. For complete details logon to www.tenderwizard.com/CCIL Executive Director /Area-II

MPS LIMITED

CIN: L22122TN1970PLC005795

Registered Office: RR Towers IV, 16/17, Super A, Thiru-vi-ka Industrial Estate Guindy, Chennai - 600 032, Tamil Nadu Corporate Office: A-1, Tower A, 4th Floor, Windsor IT Park, Sector-125, Noida, Tel: 0120-4599754

Email ID: investors@mpslimited.com Website: www.mpslimited.com

NOTICE FOR TRANSFER OF SHARES TO IEPF

Notice is hereby given by MPS Limited ("the Company") that pursuant to the IEPF Rules, 2016, the Company is required to transfer, all the equity shares of the shareholders who have not claimed the dividend for seven consecutive years i.e. from the financial year 2015-16 onwards, to the IEPF Suspense Account.

The Company has sent intimations to the concerned shareholders, at their address available, requesting them to claim their unclaimed dividend. The Company will transfer shares of the shareholders, details of which are available on the Company website at https://www.mpslimited.com/ investors-overview/ in case the Company does not receive any communication by November 22, 2022.

For further information, please contact investors@cameoindia.com or investors@mpslimited.com. For MPS LIMITED

Place: Noida Date: August 16, 2022

Sd/-Sunit Malhotra CFO & Company Secretary

ANUPAM RASAYAN INDIA LTD.

Corporate Identification Number (CIN): L24231GJ2003PLC042988 Registered Office: 8110, GIDC Industrial Estate, Sachin, Surat-394230. Gujarat, India. Tel. No.: +91-261-2398991-95; Fax: +91-261-2398996 Email: office@anupamrasayan.com, investors@anupamrasayan.com Website: www.anupamrasayan.com

NOTICE OF NINETEENTH (19T) ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION, RECORD DATE, BOOK CLOSURE DATE, DATE OF PAYMENT OF DIVIDEND

Notice is hereby given that on account of the ongoing covid-19 pandemic situation, the Nineteenth (19*) Annual General Meeting (AGM) of the Members of Anupam Rasayan India Limited (the "Company") will be held on Thursday, September 15, 2022, at 4:30 p.m. (IST) through Video Conferencing ("VC") facility / Other Audio Visual Means ("OAVM") to transact the businesses, as set out in the Notice of AGM. The Company has sent the Notice of AGM along with the Integrated Annual Report for the financial year 2021-22 on August 16, 2022, through electronic mode only to the Members whose e-mail addresses are registered with the Company/Depositories in accordance with the Circular No. 02/2021 dated January 13, 2021 read together with Circular No. 14/2020 dated April 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 20/2020 dated May 5, 2020, Circular No. 21/2021 dated December 14, 2021, Circular No. 02/2022 dated May 05, 2022 and all other relevant circulars issued from time to time, issued by the Ministry of Corporate Affairs ("MCA") and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 read with Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022, issued by the Securities and Exchange Board of India ("SEBI") (collectively referred as 'Circulars'). The Notice of the AGM and Annual Report 2021-22 are also available on the Company's website at www.anupamrasayan.com and on the websites of Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com and Notice of AGM is available on the website of National Securities Depositories Limited (NSDL) at http://www.evoting.nsdl.com

In compliance with Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, each as amended from time to time and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards on General Meetings ("SS-2") issued by the Institute of Company Secretaries of India, each as amended from time to time, and above mentioned Circulars, Members are provided with the facility to cast their votes on all the resolutions set forth in the Notice of the 19" AGM using electronic voting system (e-voting) provided by the National Securities Depositories Limited ("NSDL"). The voting rights of the Members shall be in proportion to their shares of the paid-up equity share capital of the Company as on the cut-off date i.e. Thursday, September 8, 2022. The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its

Members to cast their votes on all the resolutions which are set out in the Notice of the 19" AGM. Members have the option to cast their vote on any of the resolutions using remote e-voting facility or e-voting facility during the AGM. Detailed procedure for remote e-voting/e-voting during the AGM is provided in the Notice of the AGM. The remote e-voting period commences on Monday, September 12, 2022 (9:00 a.m. IST) and ends on Wednesday, September 14, 2022 (5:00 p.m. IST). The remote e-voting module shall be disabled by NSDL thereafter. Members who have cast their votes by remote e-voting on the resolutions prior to the AGM may attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes on such resolutions again. Any person who acquires the shares of the Company and becomes a Member after the Notice is sent and holding shares as of the cut-off date, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if a

a resolution is cast by the Member, the Member shall not be allowed to change it Members holding shares in electronic mode and who acquire shares of the Company and becomes a Member of the Company after the Notice is sent and holding shares as of the cut-off date may follow steps mentioned in Notice of the

Member is already registered with NSDL for remote e-voting, then such Member

can use their existing user ID and password for casting the vote. Once the vote on

The Board of Directors of the Company have appointed Mr Mohan Baid, Practicing Company Secretary (Membership No. A3598; COP: 3873) as the Scrutinizer to scrutinize the remote e-voting and e-voting at AGM process in a fair and transparent manner.

In case of any queries, Members may refer the Frequently Asked Questions (FAQs) and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com. Shareholders/Members, who need assistance before or during the AGM, can contact NSDL official Ms Sarita Mote on toll free no.: 1800-1020-990 and 1800-22-44-30 or send a request at evoting@nsdl.co.in. Helpdesk for Individual shareholders holding securities in demat mode for any and the second second description of the second children of the seco

Login type	Helpdesk details		
Individual Shareholders holding securities in demat mode with NSDL	Members facing any technical issue in login can contact NSDL helpdesk by sending a request at evoting@nsdl.co.in or call at toll free no.: 1800 1020 990 and 1800 22 44 30		
Individual Shareholders holding securities in demat	Members facing any technical issue in login can contact CDSL helpdesk by sending a request at		

helpdesk.evoting@cdslindia.com or contact at

022-23058738 or 022-23058542-43 Payment of Dividend and Tax Deducted at Source (TDS):

1. The Board of Directors at their meeting held on May 12, 2022, has recommended the Dividend of ₹ 1.00/- @ 10% per equity share of the face value of ₹ 10/- for the FY 2021-22, subject to the approval of the Members at the ensuing AGM of the Company. If the final dividend, as recommended by the Board of Directors, is approved at the AGM, payment of such dividend, subject to deduction of tax at source, will be made on or before October 13, 2022, to all the Beneficial Owners in respect of shares held in dematerialized form as per the data as may be made available by the National Securities Depository Limited ("NSDL") and the Central Depository Services (India) Limited ("CDSL"), collectively referred as "Depositories", as of the close of business hours on Monday, September 5, 2022. In accordance with the provisions of Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Tuesday, September 6, 2022 to Thursday, September 15, 2022 (both days inclusive).

Members may note that the Income Tax Act, 1961 ("IT Act"), as amended by the Finance Act, 2020, mandates that dividends paid or distributed by a company shall be taxable in the hands of its members. The Company shall therefore be required to deduct tax at source ("TDS") at the time of making the payment of dividend to the Members. For details on taxation, please refer AGM notice.

For Anupam Rasayan India Limited

Date: August 16, 2022 Place: Surat


mode with CDSL

Company Secretary and Compliance Officer

Adfactors 240

Ahmedabad

Suchi Agarwal



Place: Mumbai

Date : August 11, 2022









Place: Vadodara

Date: 16 August 2022



through VC/OAVM.

Vijendra Kumar Jain

Date : 17* August, 2022 Tatva Chintan Pharma Chem Limited

Registered Office: Plot No. 502 / 17, GIDC Estate, Ankleshwar, Dist. Bharuch, Gujarat - 393 002.

Tel. No.: +91 75748 48533, Fax: +91 265 2638533.

OTHER AUDIO-VISUAL MEANS ("OAVM")

The Twenty Sixth (26th) Annual General Meeting ("AGM") of TATVA

Members will be able to attend the 26th AGM through VC/OAVM mode only.

- In compliance with the aforesaid Circulars, Notice of the 26th AGM along
- Bank Accounts details for receiving dividends directly in bank accounts:
 - updated their email addresses / Bank Account details with the Company are requested to register / update the same by sending an Email at vadodara@linkintime.co.in to Company's Registrar and Share Transfer Agent, M/s. Link Intime India Private Limited by quoting their Folio Number and attaching a self-attested copy of PAN Aadhaar Card and cancelled cheque leaf.
 - demat accounts.

છેતરપિંડીમાંથી આઝાદી મેળવવા માટે એચડીએફસી બેંકે 'पिषित आन्टी' नामनुं अभियान तोन्य इर्य्

એચડીએફસી બેંકે આજે જાહેર કર્યું છે કે, બેંક 'વિજિલ આન્ટી' નામનું નવું અભિયાન લોન્ચ કરીને ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી કરશે. આ અભિયાન સમગ્ર દેશમાં લોકોને બેંકિંગવ્યવહારો સલામતીપૂર્વક હાથ ધરવા માટે પ્રોત્સાહિત કરશે. આ અભિયાન બેંકના ખૂબ જ પ્રચલિત 'મુંડ બંધ રખો' અભિયાનને પૂરક બની રહેશે, જેમાં લોકોને તેમની બેંકિંગ સંબંધિત ખાનગી માહિતી અન્યોને નહીં આપવા માટે વિનંતી કરવામાં આવે છે. લોલા કુટ્ટી પાત્રને ખૂબ જ પ્રચલિત બનાવનારા સૃશ્રી અનુરાધા (અનુ) મેનન આ અભિયાનના હિમાયતીઓમાંથી એક હશે. વિજિલ આન્ટી તરીકે સુશ્રી અનુરાધા મેનન વીડિયો, રીલ્સ, ચેટ શોની શ્રેણી મારફતે સલામત બેંકિંગમાં શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તેની પર જાગૃતિ પેદા કરશે. વિજિલ આન્ટી નાણાકીય છેતરપિંડી કરનારાઓની મોડસ ઓપરેનડી. સાઇબર ફોડના પ્રયત્નોની જાણકારી મેળવવાના માર્ગોઅને કેવી રીતે સલામત રહેવું તે અંગે નાગરિકોને માહિતગાર રાખીતેમને જાગૃત રહેવા માટે પ્રોત્સાહિત કરશે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચેટ શોને હોસ્ટ કરશે તથા સેલિબ્રિટી ગેસ્ટની સાથે સાઇબર ફ્રોડની કેટલીક તાજેતરની ઘટનાઓ અંગે ચર્ચા કરશે. વિજિલ આન્ટી ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર દબદબો ધરાવનાર એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હશે. ગ્રાહકો સાથે જોડાઈ શકાય તે માટે તેનો પોતાનો એક વોટ્સએપ નંબર (+૯૧ ૭૨૯૦૦૩૦૦૦૦) પણ હશે. એચડીએફસી બેંકની વેબસાઇટના એક

વડોદરાએ આઝાદીકા અમત મહોત્સવ

ની ચાલી રહેલી ઉજવણીના ભાગ રૂપે

યુનિવર્સિટી કેમ્પસમાં ૭૬મો સ્વતંત્રતા

દિવસ ધુમધામ થી ઉદ્ઘાસભેર ઉજવ્યો

હતો. યુનિવર્સીટીના પ્રોવોસ્ટ પ્રો.

(ડો.) અવની ઉમટ એ રાષ્ટ્રધ્વજ

ફરકાવ્યો હતો અને ત્યારબાદ

યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન

શૈક્ષણિક કર્મચારીઓ અને

વિદ્યાર્થીઓની હાજરી માં રાષ્ટ્રગીતનું

ગાન કરવામાં આવ્યું હતું. પ્રો. ઉમટ

એ પોતાના સંબોધનમાં "આત્મનિર્ભર

ભારત" માટે "જન આંદોલન" ની

જરૂરિયાત ઉપર ભાર મૂકી તેને સફળ

બનાવવાના શપથ લેવા માટે યુવાનોને

પેજ પર ફક્તને ફક્તસાઇબર ફ્રોડ પર જાગૃતિ પેદા કરવામાં આવશે.

આ અભિયાનના લોન્ચ અંગે ટિપ્પણી કરતાં એચડીએફસી બેંકના ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઑફિસર સમીર રાતોલિકરે જણાવ્યું હતું કે, 'ધૃતારાઓ ગ્રાહકોના બેંક ખાતામાંથી નાણાંની તફડંચી કરવા માટે સોશિયલ એન્જિનીયરિંગના અવનવા કીમિયા અજમાવી રહ્યાં છે. કેટલીક સેવાઓ અથવા તો બાંયધરીપૂર્વકની મદદ પૂરી પાડવાના બહાને આવા ઠગ ગ્રાહકોને તેમના પિન, ઓટીપી, પાસવર્ડ અને અન્ય ખાનગી બેંકિંગ માહિતી પૂરી પાડવા લલચાવે છે. આથી ગ્રાહકોને બેંકિંગના સલામત વ્યવહારો અપનાવવા માટે શિક્ષિત કરવા તથા છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ મોડસ ઓપરેન્ડીઅંગે જાગૃત કરવા જરૂરી છે. એચડીએફસી બેંક ખાતે અમે આ જાગૃતિ પેદા કરવામાં અમારી ભૂમિકાને સારી રીતે સમજીએ છીએ.' એચડીએફસી બેંકના ચીફ માર્કેટિંગ ઑફિસર તથા કોર્પોરેટ કમ્યુનિકેશન્સ, લાયેબિલિટી પ્રોડક્ટ્સ અને મેનેજ્ડ પ્રોગ્રામસના હેડ શ્રી રવિ સંથાનમે જણાવ્યું હતું કે, 'ઓનલાઇન વિશ્વમાં ગ્રાહકો ખાનપાનથી માંડીને પ્રવાસ અને મનોરંજન સુધીના વૈવિધ્યસભર વિષયો પર માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે વધુને વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અને કન્ટેન્ટ ક્રીયેટરોની સાથે સંકળાઈ રહ્યાં છે. આથી અમે અમારો પોતાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિજિલ આન્ટીની રચના કરવાનો નિર્ણય લીધો છે, જેથી કરીને ગ્રાહકોને બેંકિંગના સલામત વ્યવહારો અંગે માહિતી પૂરી પાડી શકાય. અનુ મેનન रीभलीअ स्डिस्स युनिपर्सीरीभे

આ ભૂમિકા માટે પર્ફેક્ટ છે, કારણ કે, લોકો સાથે જોડાવામાં તેઓ ખુબ જ અસરકારક છે. વળી તેમની હસાવનારી હરકતો અને અનેક ભાષાઓ પરના તેમના પ્રભુત્ત્વને કારણે અમારું માનવું છે કે, તેઓ સમગ્ર દેશમાં લોકોને બેંકિંગના સલામત વ્યવહારો અપનાવવા માટે પ્રેરિત કરી શકશે. અમે એક એવા અભિયાન મારફતે ભારતની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે, જે આ વિષય પર જાગૃતિ ફેલાવી છેતરપિંડીમાંથી આઝાદી મેળવવાને પ્રોત્સાહન આપશે. વિજિલ આન્ટીને પ્રચલિત કરવા અને લોકો તેમને સોશિયલ મીડિયા અને/ અથવા વોટ્સએપ મારફતે ફોલો કરતાં થાય તે માટે આ અભિયાન ચારથી છ અઠવાડિયા માટે ચલાવવામાં આવશે. જોકે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે વિજિલ આન્ટી ડિજિટલ ઇકોસિસ્ટમમાં સતત ઉપસ્થિત રહેશે અને તેઓ નાણાકીય છેતરપિંડી કરનારાઓની વિવિધ મોડસ ઓપરેન્ડી અને તેમનાથી કેવી રીતે બચવું જોઇએ,તે અંગે ગ્રાહકોને માહિતીગાર

કરવાનું ચાલું રાખશે. ઉદ્ઘેખનીય છે કે, એચડીએફસી બેંક છેતરપિંડી અટકાવવા પર સક્રિય રીતે ગ્રાહકોને શિક્ષિત કરી રહી છે અને જાગૃતિ પેદા કરી રહી છે. બેંકે નવેમ્બર ૨૦૨૧થી અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સલામત બેંકિંગ પર ૨,૮૦૦થી વધારે વર્કશોપો યોજી છે. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓ, કાયદાનું અમલીકરણ કરનારી એજન્સીઓ, વરિષ્ઠ નાગરિકો, ચેનલ પાર્ટનરો અને હાઉસિંગ સોસાયટીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ

ઉત્સાહભેર સ્કૂટર રેલીમાં ભાગ લીધેલ

પર્વની ઉજવણી કરેલ હતી. વધુમાં

"History of the Indian Flag",

"Tribute to the Journey of

India's Independence" અને

Remembrance Day" અંગેની

દસ્તાવેજી ફિલ્મ્સ દર્શાવવામાં આવેલ

હતી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના

ગીતોનું ગાન પણ ગાવામાં આવ્યું હતું

અને વિદ્યાર્થીઓએ ઉદ્ઘાસભેર

"Partition

अभूतना लावमां आश्रथी વધારો ईरी

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ) દ્વારા ગુજરાત, દિલ્હી, એનસીઆર, મુંબઇ, પશ્ચિમ બંગાળ અને તમામ શહેરોમાં ૧૭ ઓગસ્ટ ૨૦૨૨થી દૂધના ભાવમાં લિટરદીઠ રૂ. ૨નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવ વધારો થતા અમલ ગોલ્ડ ૫૦૦ મિલીનો ભાવ રૂ. ૩૧ અને ૫૦૦ મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. ૨૫ અને ૫૦૦ મિલી અમલ શક્તિનો ભાવ રૂ. ૨૮ થશે.

(પ્રતિનિધિ)અમદાવાદ, તા.૧૬

ગત વર્ષની તુલનામાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજિત ૨૦ ટકા જેટલો વધારો થયો છે. કાચા માલના ભાવમાં થયેાલ વધારાને ધ્યાનમાં રાખીને અમૂલ ફેડરેશન સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ ભાવમાં પણ પાછલા વર્ષની તુલનામાં ૮-૯ ટકા જેટલો વધારો કરાયો છે.

ઉક્ષેખનીય છે કે અમૂલે ૧ માર્ચ ૨૦૨૨ના રોજ દૂધના ભાવમાં લિટરદીઠ રૂ. રનો વધારો કર્યો હતો. ૧ માર્ચ ૨૦૨થી ગુજરાતમાં અમૂલ ગોલ્ડની કિંમત ૫૦૦ મિલીના રૂ. ૩૦ કરાયા હતા. વધુમાં દૂધની પ્રોડક્ટ પર પ ટકા જીએસટી લાદવામાં આવતા ૧૯ જુલાઇએ પણ ભાવ વધ્યા હતા.

इार्धजरवेज धन्डियानो Q1 FY22 भाटे ત્રિમાસિક ધોરણે પીએટી ૩૫% વધ્યો

ફાઈબરવેબ (ઈન્ડિયા) લિમિટેડ, ૧૦૦% ઇઓયુ અને નોન-વૂવન કાપડના ઉત્પાદકોએ પોતાના ચવ ઋઢર ૩ના નોન-ઓડિટેડ પરિણામની જાહેરાત કરી. Q1 FY23ના મુખ્ય નાણાકીય બાબતો એક નજરમાં: Q1 FY23 માટે કુલ આવક ₹૧૭.૪૫ કરોડ રહી હતી Q1 FY23 માટે એબિડટા ₹૨.૯૦ કરોડ રહ્યો હતો Q1 FY23માટે પીએટી ₹ ૧.૭૦ કરોડ રહ્યો હતો Q1 FY23 માટે ઇપીએસ ₹ ૦.૫૯ રહી હતી આ પ્રસંગે બોલતા ફાઈબરવેબ (ઈન્ડિયા) લિમિટેડના ડિરેક્ટર ભાવેશ પી શેઠે જણાવ્યું, ગયા ત્રિમાસિક ગાળાએ વધુ મુલ્યવર્ધિત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરવાના અમારા પ્રયત્નો માટે પરિણામો આપવાનું શરૂ કર્યું છે. અમે

ક્વાર્ટર દરમિયાન નવા મૂલ્ય-વર્ધિત ઉત્પાદનો રજૂ કર્યા છે, જેણે અમને શિપિંગના ઉંચા ભાડા દર સામે લડવામાં મદદ કરી છે. જો અમે આ ઉત્પાદનો પર ધ્યાન ન આપ્યું હોત અને માત્ર મૂળભૂત ઉત્પાદનોનો સપ્લાય કર્યો હોત તો આ ત્રિમાસિક મુશ્કેલ હોત. અમારા અનુભવ અને બંજારોની સમજણે અમને આ મૂલ્યવર્ધિત ઉત્પાદનો સમયસર વિકસાવવામાં મદદ કરી છે. આ ઉત્પાદનો અમારા તમામ મુખ્ય ગ્રાહકો દ્વારા સ્વીકારવામાં આવ્યા છે અને અમે આ ઉત્પાદનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો ઇરાદો ધરાવીએ છીએ. એકવાર શિપિંગ ભાડા સામાન્ય થઈ ગયા પછી અમે આ મૂલ્યવર્ધિત ઉત્પાદનો અમારા નફાકારકતાના માર્જિનમાં સુધારો કરશે તેને જોઇશું.

કોંગ્રેસના નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજૂ પરમાર આજે ભાજપમાં જોડાશે, સી.

(પ્રતિનિધિ)અમદાવાદ,તા.૧ ૬ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપ અને આમ આદમી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીને પગલે સંગઠનને મજબૂત કરવા માટે રાત – દિવસ એક કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓમાં અંદરો - અંદરનો ગજગ્રાહ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. કોંગ્રેસમાં ચૂંટણી પહેલા વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. કોંગ્રેસના નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. તેઓ આવતીકાલે ૧૭ ઓગસ્ટે ભાજપ અધ્યક્ષ સી.આર,પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કેસરી ખેસ ધારણ કરશે.અત્રે

કુબેરદાદાના દર્શન અને પૂજા-અર્ચના કરી મંત્રી પ્રદિપભાઈ પરમારે

વડોદરા, તા.૧ ક શ્રાવણ માસનો સોમવાર અને શ્રી કબેર ભંડારેશ્વર દાદાના દર્શન - આ બંનેનો સુવર્ણ સંગમ થાય એટલે સઘળી મનોકામના પૂર્ણ થાય છે. ખળખળ વહેતી મૈકલ કન્યા નર્મદાના તટ ઉપર રમણીય વાતાવરણમાં આવેલા આ મંદિરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમારે આજે દેવોના ખજાનચી એવા સુપ્રસિધ્ધ કુબેર ભંડારી મંદિર,કરનાળીની મુલાકાત લીધી હતી. અને કુબેરદાદાના ભક્તિભાવપૂર્વક દર્શન કરી પૂજન કર્યું હતું. મંદીર સંકુલમાં મુખ્ય મંદીર એવા કુબેરેશ્વર મહાદેવના દર્શન કરતા પહેલા મંત્રીએ ગીતા મંદિરના દર્શન કર્યા હતા. ત્યારબાદ કુબેરદાદાના દર્શન કરી નર્મદા નદી પાસે જતા મહાકાળી માતાના મંદિરમાં પણ મંત્રીએ માથું ટેકવી પ્રાર્થના કરી હતી. અહીંથી તેઓ પગથિયા ઉતરીને નર્મદાના કિનારે પહોંચ્યા હતા અને નર્મદા મૈયા સમક્ષ હાથ જોડ્યા હતા. ત્યારબાદ પરત ફરતી વેળા મંદિર પરિસરમાં આવેલા સુંદર એવા રણછોડજીના મંદિરના પણ તેમણે દર્શન કર્યા હતા. મંદિર પરિસરમાં મંદિરના દ્રસ્ટી રજનીભાઈ પંડ્યા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મંત્રીને આવકારી

સન્માન કર્યું હતું.

ઉદ્ઘેખનીય છે કે, આવતીકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપના હોદ્દેદારોની મહત્વની બેઠક યોજાનાર છે જેમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અને ચંટ્રણીલક્ષી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. આ પ્રસંગે જ કોંગ્રેસના બંને નેતાઓ અનેક આગેવાનો સાથે ભાજપમાં સામેલ થવાના છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષમાં અવગણનાને કારણે નરેશ રાવલ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા છે. જેને કારણે તેમણે હવે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે કોંગ્રેસની સ્થિતિ ગુજરાતમાં એક સાંધો ત્યાં તેર ત્રુટે જેવી થતી રહી છે. આ સંજોગોમાં નરેશ રાવલ અને રાજુ પરમાર જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને ફટકો પડ્યો છે. ભાજપનો ખેસ ધારણ કરે તે પહેલા બંને નેતાઓએ દિક્ષીમાં વડાપ્રધાન મોદી સાથે મલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઉદ્ઘેખનીય છે કે નરેશ રાવલ પર્વ ગૃહમંત્રી અને વિપક્ષ નેતા રહી ચૂક્યા છે જ્યારે રાજુ પરમાર કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

આવ્યું છે. જ્યારે જિલ્લામાં પરમીટ ધારક બે કંપનીઓ દ્વારા ૨૩૫૦ વૃક્ષોનું પ્રશસ્ય સહયોગ મળ્યો હતો. તમામ વિવિધ વિસ્તારોમાં વાવેતર કરવામાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આવ્યું છે. તેમણે ઉમેર્યું કે પર્યાવરણ લક્ષી ઉમળકાભેર વૃક્ષો વાવી તેના જતન અને

ખાણ ખનિજ કચેરી દ્વારા આઝાદીના અમૃત પર્વે

વડોદરા જિલ્લાની ૩७૬ શાળાઓમાં

શહિદોની સ્મૃતિમાં ૧૬૩૭૫ વૃક્ષોનું વાવેતર

છોટાઉદેપુર વનવિભાગ દ્વારા વિનામુલ્યે રોપાઓ પૂરા પાડવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. જિલ્લાની બાકી રહેલ શાળાઓને તબક્કાવાર આવરી લેવા

અધિકારી કચેરી અને વનવિભાગનો

આ નેક કાર્યમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંવર્ધન માટે સંકલ્પબધ્ધ બન્યા હતા. આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. ध्वर वंदन डार्यङ्गमां मंत्रीना हस्ते

ઐતિહાસિક નગરી ડભોઇ ખાતે ૭૬માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે યોજાયેલા ધ્વજ વંદન કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઇ પરમાર ના હસ્તે પ્રાદેશિક માહિતી કચેરી વડોદરાના બે કર્મયોગીઓ વિડિયોગ્રાફર મનોજ નગરશેઠ અને તસવીરકાર હાર્દિક પરમારનું ઉમદા અને સમર્પિત

આઝાદીના અમૃત પર્વે વડોદરા

જિલ્લામાં કલેકટર અતૃલ ગોરના

માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ

વિભાગની કચેરી,વડોદરા દ્વારા

વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં

આવ્યું હતું. ૭૬ માં સ્વાતંત્ર્ય દિને

વડોદરા જિલ્લામાં ૨૬,૨૨૫ વૃક્ષોનું

વાવેતર કરવામાં આવ્યું હોવાનું ખાણ

ખનીજ વિભાગના અધિકારી નિરવ

બારોટે જણાવ્યું છે. બારોટે જણાવ્યું કે

વડોદરા જિલ્લાના ડેસર, સાવલી,

કરજણ,ડભોઈ અને વાઘોડિયા તાલુકાની

૩૭૬ પ્રાથમિક શાળાઓમાં આઝાદીના

જંગમાં શહિદ થયેલા વીરોની સ્મૃતિમાં

૧૬,૩૭૫ વૃક્ષોનું વાવેતર કરવામાં

આવ્યું હતું. આ તાલુકાઓમાં લીઝ

ધારકો દ્વારા ૭૫૦૦ સહિત કુલ

૨૬,૨૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં

ઉદ્ઘેખનીય છે કે આ સમારોહમાં ઉત્તમ કામગીરી કરનારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મયોગીઓ નું બહુમાન કરીને તેમને પ્રોતસાહિત કરવામાં આવે છે.

સેવાઓ માટે બહમાન કરવામાં

આવ્યું હતું.

આ વર્ષે આ કાર્યક્રમમાં મનોજભાઈ અને હાર્દિકભાઈનું અવિરત સેવાઓ માટે સન્માન કરવાની ભલામણ સંયુક્ત માહિતી નિયામક આર.આર.રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

આ બંને કર્મયોગીઓ કોરોના જેવી કટોકટી હોય,પુર કે વાવાઝોડાની આફતો હોય, પ્રધાનમંત્રી, રાજ્યપાલ મુખ્યમંત્રીના કાર્યક્રમો હોય,પ્રત્યેક પ્રસંગે,વડોદરા જિ ક્ષામાં અને જિલ્લાઓમાં,વાઇબ્રન્ટ ગુજરાત જેવા રાજ્યસ્તરના કાર્યક્રમોમાં થાક્યા વગર સેવાઓ આપીને.રાજ્ય સરકારના પ્રચાર પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન આપે છે.

કોવીડ દરમિયાન તેમણે જોખમી પરિસિથતિમાં સતત કામગીરી કરી હતી અને સંક્રમિત થયાં પછી પણ સાજા થઈને નીડરપણે કામ કરવાની

માહિતી ખાતાના કર્મચોગીઓ સન્માનિત

તેમના સન્માનથી માહિતી પરિવાર વડોદરામાં આનંદની લાગણી પ્રસરી છે.

બાબુભાઈ દેસાઈ અને સમગ્ર માહિતી પરિવારે સન્માનિતો ને અભિનંદન પાઠવ્યા છે.

તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ (અગાઉ તત્વ ચિંતન ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ) CIN: L24232GJ1996PLC029894

છ. ઓફિસ : પ્લોટ નં.૫૦૨ / ૧૭, છઆઈડીસી એસ્ટેટ, અંકલેશ્વર, જિલ્લો : ભરુચ, ગુજરાત-૩૯૩ ૦૦૨ จัดลเยื่อ: www.tatvachintan.com ย-ลัยส: cs@tatvachintan.com ટેલીફોન નંબર:+૯૧ ૭૫૭૪૮ ૪૮૫૩૩ ફેક્સ:+૯૧ ૨૬૫ ૨૬૩૮૫૩૩

તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડની વિડિયો કોન્ફરન્સીંગ ("વીસી") અન્ય ઓડિયો-વિઝયુઅલ સાધનો ("ઓએવીએમ") થી યોજાનાર રકમી વાર્ષિક સાધારણ સભા વિશેની માહિતી અંગેની સૂચના

નાથી સૂચના આપવામાં આવે છે કે :

૧. **તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ ("કંપની")** ની છવ્વીસમી ("૨૬મી") વાર્ષિ સાધારણ સભા ("એજીએમ") ગુરુવાર, તારીખ રસ્મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સાંજે ૪-૦૦ કલાકે (આઇએસટી) વીડિયો કોન્ફરન્સીંગ ("વીસી")/અન્ય ઓડિયો-વિઝયુઅલ સાધનો ("ઓએવીએમ") દ્વારા યોજવામાં આવેલ છે, કે જે કંપનીઝ એક્ટ, ૨૦૧૩ અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમો તેમજ ધી સિકયુરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ એફ ઈન્ડિયા ("સેબી") (લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડીસ્કલોઝર રીકવારમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ("લીસ્ટીંગ રેગ્યુલેશન્સ") અને તેમાં વખતો વખત કરવામાં આવેલા સુઘારા અને સામાન્ય પરિપત્ર તારીખ ૮મી એપ્રિલ ૦૨૦, ૧૩મી એપ્રિલ ૨૦૨૦, પર્મો મે ૨૦૨૦, ૧૩મી જાન્યુઆ ડિસેમ્બર ૨૦૨૧ અને પમી મે ૨૦૨૨ અને અન્ય લાગુ પડતા પરિપત્રો કે જે કોર્પોરેટ બાબતોના મંત્રાલય ("એમસીએ") દ્વારા બહાર પાડવામાં આવેલ છે અને સિક્યુરીટીટ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા ("સેબી") દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપર તારીખ ૧૨મી મે ૨૦૨૦, ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧, અને ૧૩મી મે ૨૦૨૨ (જે હ^ર પછી સામૂહિક રીતે "પરિપત્રો" તરીકે ઓળખાશે) ની સાથે વાંચતા, બહાર પાડવામ આવેલી જોગવાઈઓના પાલન અર્થે અને રકર્મી વાર્ષિક સાધારણ સભા યોજવાની સચનામાં દર્શવિલ વ્યવહારો કરવા માટે ચોજવામાં આવેલ છે.

કંપની ના સદસ્યો રકમી વાર્ષિક સાધારણ સભામાં ફકત વીસી/ઓવીએએમન માધ્યમથી જ ભાગ લઈ શકશે. એજીએમ માં ભાગ લેવા માટેની વિસ્તૃત માહિતી એજીએમ માટેની સૂચનામાં આપવામા આવશે. વીસી/ઓવીએએમ ના માદ્યમથી બેઠકમાં ભાગ લેતા સદસ્યોની હાજરી કંપનીઝ એકટ, ૨૦૧૩ ની કલમ ૧૦૩ હેઠળ કોરમના હેતુસ

ર. ઉપર જણાવેલ પરિપત્રોનું પાલન કરતા, નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના વાર્ષિક અદેવાલ સાથે ૨૬મી વાર્ષિક સાધારણ સભા ચોજવાની સૂચના, એવા સદસ્યો કે જેમનું ઈ-મેઈલ સરનામું કંપની/ડિપોઝિટોરીમાં નોંધાયેલ છે, ફકત તેમને જ ઈલેક્ટ્રોનીક માધ્યમથી મોકલવામાં આવશે, સદસ્યો એ પણ નોંધ લે કે સંબંધિત સૂચના અને વાર્ષિક અદેવાલ કંપનીની વેબસાઇટ <u>www.tatvachintan.com</u> અને સ્ટોક એકસચેન્જર્ન વેબસાઇટ એટલે કે બીએસઈ લિમિટેક ("**બીએસઈ")** અને નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ **("એનએસઈ"**) ની વેબસાઇટ અનુક્રમે <u>www.bseindia.con</u> અને www.nseindia.com પર ઉપલબ્ધ રहેશે. તદ્ઉપરાંત લિંક ઈનટાઈમ ઈન્ડિય પ્રાઈવેટ લિમિટેડ કે જે વીસી/ઓવીએએમ દ્વારા વાર્ષિક સાધારણ સભા ચોજવા અને રિમોટ ઈ-વોરીંગ તેમજ સભા દરમ્યાન ઈ-વોરીંગની સુવિધા આપવા નિયુક્ત કરેલ એજન્સી છે, તેની વેબસાઈટ <u>https://instavote.linkintime.co.in</u> પર પણ ઉપલબ્ધ રહેશે.

૩. કંપની દ્વારા ઈલેકટ્રોનિક માધ્યમથી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવા માટે ઈ-મેઈલ સરનામ્ અને સીધા બેંક ખાતાઓમાં ડિવિડન્ડ મેળવવા માટે બેક ખાતાની વિગતોન નોંધણી/સુધારો કરવાની રીત:

(i) **ભોતિક સ્વરૂપમાં** શેર ધરાવતા સદસ્ચો, કે જેમણે કંપની પાસે પોતાના ઈ-મેઈલ સરનામું/બેંક ખાતાની વિગતો નોંઘાવેલ નથી, તેમને પોતાના ઈ-મેઈલ સરનામું / બેંક ખાતાની વિગતો તેમના ફોલિયો નંબર દર્શાવતો તથા પાન, આધાર કાર્ડ, કેન્સલ કરેલ ચેકની સ્વ-પ્રમાણિત નકલો સાથેનો ઈ-મેઈલ કંપનીન રજીસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ, મેસર્સ લિંક ઈન ટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ને vadodara@linkintime.co.in પર મોકલીને નોંધાવી દેવાની વિનંતી કરવામાં આવે છે.

(ii) **ડીમટીરીયલાઈઝડ સ્વરૂપમાં** શેર ધરાવતા સદસ્યો, કે જેમણે ડિપોઝીટરી પાર્ટીસીપન્ટ્સ પાસે પોતાના ઈ-મેઈલ સરનામું/બેંક ખાતાની વિગતો નોંધાવેલ નથી, તેમને તેઓ તેમના કિમેટ ખાતાઓ જેમની સાથે જાળવી રાખે છે તે કિપોઝીટરી પાર્ટીસીપન્ટ્સ સાથે પોતાના ઈ-મેઈલ સરનામું / બેંક ખાતાની વિગતો નોંધાવવા/સુધારો કરાવવાની વિનંતી કરવામાં આવે છે.

જ. ઈ-વોટીંગ દ્વારા મતદાન કરવાની પધ્ધતિ :

(i) સદસ્યોને રકમી વાર્ષિક સાધારણ સભા યોજવાની સૂચનામાં દર્શાવેલ વ્યવહારો પર ઈલેકટ્રોનિક વોટીંગ સિસ્ટમ એટલે કે ઈ-વોર્ટીંગથી મત આપવાની તક

(ii) એજીએમ ની સૂચનામાં જે સદસ્યો ડીમટીરીયલાઈઝડ સ્વરૂપમાં શેર ધરાવે છે. ભોતિક સ્વરૂપમાં શેર ઘરાવે છે અને એવા સદસ્યો જેમણે એમનું ઈ-મેઈલ સરનામુ નોંઘાવ્યું નથી તે કેવી રીતે રીમોટ ઈ-વોર્ટીંગ કરી શકશે તે જણાવવામાં આવ્યું છે.

(iii) ઇલેકટ્રોનિક વોર્ટીંગ સિસ્ટમના માધ્યમથી ઈ-વોર્ટીંગની સુવિધા એજીએમન સમયે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. માત્ર એવા શેર ધારકો કે જેઓ એજીએમમાં વીસી/ઓવીએએમના માધ્યમથી ભાગ લઈ રહ્યાં છે અને જેમને રીમોટ ઈ-વોર્ટીંગથી ઠરાવો પર પોતાનો મત આપ્યો નથી અને જેઓને અન્ય રીતે એવું કરવાથી બાકાત કરવામાં આવ્યા નથી, તેઓ જ એજીએમ દરમિયાન ઉપલબ્ધ ઈ-વોર્ટીંગ સિસ્ટમથી મત આપવાને પાત્ર ગણાશે.

ા. ૨૬મી એજીએમની તારીખ ૨૫મી જુલાઈ ૨૦૨૨ ની સૂચનામાં જણાવેલી નોંઘો, અને ખાસ કરીને એજીએમ માં જોડાવા માટેની સૂચનાઓ, રીમોટ ઈ-વોર્ટીંગ દ્વારા અથવ એજીએમ દરમિયાન ઈ-વોટીંગ દ્વારા મત આપવાની પદ્ધતિ, કાળજી પૂર્વક વાંચી જવ

બોર્ડના આદેશર્થ તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડ વતી

એમ.નં. : એ૩૭૪૪૪

કંપની સેક્રેટરી અને કમ્પ્લાયન્સ ઓફિસર

રમતગમતમાં ભાગ લીધેલ હતો. બનાવવા આપણા સૌની સામુહિક આર્ટિકલ્સ અને ૨ પેટન્ટ નો ઉક્ષેખ ૭ ૬ માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની જવાબદારી છે તેમ જણાવેલ. વધુમાં, કરીને સૌને બિરદાવ્યા હતા. સ્વતંત્રતા સફળતા માટે યુનિવર્સિટીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સને દિવસ ની ઉજવણીના ભાગ રૂપે ૨૦૪૭ માં આઝાદીના ૧૦૦ વર્ષ પ્રોવોસ્ટ પ્રો. (ડો.) અવની ઉમટ અને એનએસએસ વિભાગ, રસરંગ ક્લબ રજિસ્ટ્રાર પ્રો. એચ. સી. ત્રિવેદી ની અને સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભારે જહેમત સુધીમાં ભારતને વિકસિત દેશ

ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સીટી, જે હાકલ કરેલ છે તેની યાદ અપાવી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક

અને જય જવાન, જય કિસાન,

વડાપ્રધાન એ કરી હતી તેની સમજ

પણ સૌને આપેલ હતી. દેશને આઝાદી

અપાવવા માટે પૂ. ગાંધીબાપુના

યોગદાનને બિરદાવીને અન્ય સ્વતંત્રતા

સંગ્રામીઓને યાદ કરીને તેમના પ્રત્યે

કુતજ્ઞતા વ્યક્ત કરી હતી. અંતમાં,

યનિવર્સીટીને NAAC દ્વારા "B" ગ્રેડ

ની માન્યતા પ્રાપ્ત થયેલ બાબતે તેમજ

સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટી ના શૈક્ષણિક

સ્ટાફ દ્વારા પ્રસિદ્ધ થયેલ રિસર્ચ

જય વિજ્ઞાન ના નારામાં જય અનુસાધન 🔝 હતો અને યુનિવર્સિટીએ ચારસો થી

ઉમેરવાની આવશ્યકતાની જે વાત પણ વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી

અદાણી લોજીસ્ટિકસે આઇસીડી તુમ્બ હસ્તગત કર્યો

રાહબરી હેઠળ યુનિવર્સિટીના તમામ ઉઠાવવામાં આવી હતી.

३. ८३५ हरोडनी अन्टरप्रार्धि हिंभते हस्तगत

અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઝોન (એપીએસઇઝેડ) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સ લિ. (એલએલએલ) એ નવકાર કોર્પોરેશન લિમિટેડ પાસેથી વાપીના તુમ્બ ખાતેનો આઇસીડી (ઇનલેન્ડ કન્ટેનર ડિપો) રૂ. ૮૩૫ કરોડની એન્ટરપ્રાઇઝ કિંમતે હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ સોદામાં ૦.૫ મિલિયન ટીઇય્ હેન્ડલ કરવાની ક્ષમતા સાથે કાર્યરત આઇસીડીના સંપાદનનો સમાવેશ થાય છે. ડેડીકેટેડ ફેઇટ કોરીડોરના સ્ટ સાથેવધારાનાઔદ્યોગિક કોરિડોર અને લોજિસ્ટિક પાર્ક ઉમેરાયા હોવાથી વધારવા માટે વધારાનો વિસ્તરણ માર્ગ આ ડેપો સાથે સંલગ્ન ૧૨૯ એકર જમીન પૂરો પાડે છે તુમ્બ આઇસીડી પાસે પશ્ચિમ ડેડીકેટેડ ફેઇટ કોરીડોર સાથે ચાર રેલ હેન્ડલિંગ લાઈનો અને એક ખાનગી ફ્રેઈટ ટર્મિનલ છે અને તેમાં કસ્ટમ નોટિફાઈડ જમીન અને બોન્ડેડ વેરહાઉસની સવલત છે

અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.ના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણ સમયના ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે તુમ્બ એ દેશના સૌથી વિશાળ આઇસીડી પૈકીનો સૌથી વધુ ધમધમતો ડેપો છે. સૌથી વ્યસ્ત ઔદ્યોગિક ઝોન પૈકીના એકની વચ્ચે તેની વ્યૂહાત્મક સ્થિતિને જોતાં અને ડેડીકેટેડ ફેઇટ કોરિડોર

આવેલા સતત કામગીરીથી ધમધમતા હઝીરા અને ન્હાવા શેવા બંદરોની ઍક્સેસ સાથે વિશાળ અંતરિયાળ વિસ્તારને અર્થપૂર્ણ સેવા પૂરી પાડવા માટે મોકળાશ આપે છે.

જમીનની કિંમત અને વર્તમાન અસ્કયામતોના રિપ્લેસમેન્ટ ખર્ચ પર આધારિત આ સંપાદનની રૂ.૮૩૫ કરોડનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩ના ૭.૮ ગણી ઇબીઆઇટીડીએના આધારે ઇવી/ ઇબીઆઇટીડીએ સૂચવે છે. આ સોદો પરંપરાગત નિયમનો અને ધિરાણકર્તાની મંજૂરીઓને આધીન છે અને નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક

ગાળામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

Samrat Pharmachem Limited Regd Office: Plot No. A2/3445, GIDC, Phase 4, Ankleshwar - 393 002, Gujarat (Website: www.samratpharmachem.c Corp Office: 701/702 Business Square, M. A. Road, Andheri (West), Mumbai - 400 058 (CIN: L24230GJ1992PLC017820) Extract of the Standalone Un-Audited Financial Results for the

quarter ended 30 Jun 2022 (Rs. In Lakhs except earnings per share Quarter Ended Quarter Ended 30-Jun-22 Income from operations 8653.21 4739.18 Net Profit / (Loss) for the period 125.78 (before Tax, Exceptional and/or Extraordinary items Net Profit / (Loss) for the period before tax 1252.68 125.78 (after Exceptional and/or Extraordinary items) 95.35 Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items 308.97 308.97 Equity Share Capita Earnings per share 30.32 3.09

The above results were reviewed by the Audit Committee of the Board of Directors The Statutory Auditors have carried out a limited review of the results for the quarte ended 30 Jun 2022.

The above unaudited results have been taken on record by the Board of Directors a its Meeting held on Saturday, 13 August 2022 at the Corporate Office of the Company. . Figures for the previous period have been regrouped / reclassfied, wherever necessary

Diluted

Date :13-Aug-22

Executive Director

3.09

તારીખ : ૧૬મી ઓગસ્ટ ૨૦૨૨

સ્થળ : વકોદરા